

Ref No.: Orient/Stock Exch/Letter/238

12th November, 2020

The Dy. General Manager, Corporate Relations & Services Dept., Bombay Stock Exchange Limited Phirojsha Jeejibhoy Towers, Dalal Street, Mumbai - 400 023.

Scrip Code: 504879

The Dy. Gen. Manager, National Stock Exchange of India Ltd., Corporate Relations Dept., Exchange Plaza, Bandra-Kurla Complex Bandra (E), Mumbai – 400 051. Scrip Code: ORIENTABRA

Sub: <u>Compliance under Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure</u> <u>Requirement), Regulation, 2015.</u>

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of Newspaper Advertisements published on 12th November, 2020 regarding the Annual General Meeting of the Company for the Financial Year 2019-2020.

Kindly take this on your record.

Thanking you,

Thanking you,

Yours faithfully, FOR ORIENT ABRASIVES LIMITED

BIMAL PARMAR COMPANY SECRETARY

Orient Abrasives Limited (Associate of Ashapura Group)

Registered Office : G. I.D.C Industrial Area, Porbandar - 360 577, Gujarat, India. Tel : +91-286-2221788/9, Fax: +91-286-2222719 Website : www.orientabrasives.com Email : orientabrasives@oalmail.co.in, investor@oalmail.co.in CIN - L24299GJ1971PLC093248

Administrative Office : Jeevan Udyog Building. 2nd Floor, 278. Dr. D. N Road, Fort, Mumbai - 400 001, India. Tel : +91-22 6665 1700, Fax : +01 22 2207 9395

પ

સમાચાર સંક્ષેપમાં

જાંબુડિચા ગામ પાસે મજૂરની

હત્થા કરનાર ત્રિપુટી ઝડપાઇ

પરપ્રાંતીય મજૂરની હત્યા કરવાના ગુનામાં પોલીસે બે શખસોને ઝડપી

લીધા હતા. તેમજ એક શખસને અમરેલી એસઓજીના સ્ટાફે ઝડપી લઈ

મોરબી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે નવ મોબાઈલ અને એક

બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની વિગત

એવી છે કે મોરબીના જાંબુડિયા ગામ પાસે પરપ્રાંતીય મજૂરની છરીના

ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો

હતો. દરમિયાન બંધુનગર પાસે વાહન ચેર્કીંગમાં રહેલા પોલીસ સ્ટાફે

બાઈકમાં નીકળેલા રમેશ ઉર્ફે રમલો ટપુ વાઘેલીયા અને હરસખ કાળુ

વાઘેલીયાને ઝડપી લઈ તલાસી લેતા નવ મોબાઈલ મળી આવતા બન્ને

શખસોની આકરી પૂછતાછ કરતા મજૂર યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગત તા.૩૧/૧૦ ના જાંબુડિયા

ગામ પાસે મજૂરની છરી મારી હત્યા કર્યાની કબૂલાત આપી હતી.

ત્રણેય શખસોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

મોરબી, તા.૧૧ ઃ મોરબીના જાંબુડિયા ગામ પાસે લૂંટના ઈરાદે

સાગધ્રા પાસેથી બે અબોલ જીવને બચાવતા જીવદયાપ્રેમીઓ

મળી તાલુકાના ભેટ ગામથી ઉંડવી તરફ જવાના રસ્તા પરથી એક ઈકો ગાડીમાં કસણતી હાલતમાં બે ધણખુંટને બેરહેમીથી બાંધીને લઈ જતાં હોવાથી સાગધા ગામના જુગાભાઈ ગેલાભાઈ સરપંચને શક પડતાં મુળી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના દિપકસિંહ ઝાલા સહિત જીવદયાપ્રેમી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ગાડી ચાલક તેમજ અન્ય શખસ ગાડી રેઢી મૂકીને નાસી ગયા હતાં. પોલીસને જાણ કરી ધોરણસર

અમરેલીઃ ચુવાનનું રિક્ષા અડફેટે મૃત્યુ

અમરેલી, તા.૧૧ : અમરેલીના નાના માચીયાળા ગામે રહેતા પરેશભાઈ લવજીભાઈ જાવિયા નામના ખેડૂત ગઈકાલે તેની શીંગ વેચવા અમરેલી માર્કેટયાર્ડમાં ગયા હતા પરંતુ શીંગના વેચાણમાં વારો નહીં આવતા બાઈક લઈને પરત ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન ચીતલ રોડ પરના ખોડીયાર મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી રિક્ષાએ બાઈકને અડકેટે લેતા રૂંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને પરેશભાઈનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.પોલીસે ભોલાભાઈ જાગાભાઈ જાવિયાની ફરિયાદ પરથી રિક્ષા રેઢી મુકી ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

🚯 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ્રી છે. આર.એ.-એચ.એ.: 'અરવિદભાઇ મછીઆર નાગરિક સેવાલય', ૧૫૦' રીંગ રોડ, દેવા સર્કલ પાસે, સજકોટ, ફોનર ૫૫૫૫૫૫ સિવીલ કામ અંગેની ટેન્ડર નોટિસ બેંકની ગાંધીનગર શાખા માટે નવા બિલ્ડીંગનું બાંધકામ કરાવવા માટે અનુભવી તેમજ નિચત લાચકાત ધરાવતા સિવીલ કામનાં કોન્ટ્રાકટર્સ પાસેથી ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ અંગે વિગતવાર માહિતી વેબસાઇટ https://www.nprocurement.com અથવા https://rnsb.nprocure.com પરથી મળી શકશે. નિયત શર્તો મુજબ સંપુર્ણ વિગતે ટેન્ડર ભરવાની અંતિમ તા. ૨૪/૧૧/૨૦૨૦ છે.

સુરતમાં વેપારી પિતા-પુત્ર બે કરોડથી વધુનું કૂલેકું ફેરવી ફરાર

૪૦ વર્ષથી દુકાન ધરાવતા વેપારીએ ગ્રાહકો-વેપારીઓને ઝપટમાં લીધા

સુરત, તા.૧૧ ઃ સુરતના ક્તારગામ વિસ્તારમાં ૪૦ વર્ષથી જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પિતા-પુત્ર બે કરોડથી વધુનું ફૂલેકું ફેરવી કરાર થઈ ગયાની કરિયાદ પોલીસમાં નોધાવાઇ હતી. પોલીસે પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે સુરતના ક્તારગામ દરવાજા કુબેરનગર વિભાગ-૧માં મા શક્તિ જ્વેલર્સ નામે દુકાન ધરાવતા વેપારી પિતા-પુત્ર દિલીપ જયંતિલાલ સોની સાથે વેપારી રાજેશભાઈ મહેન્દ્રકુમાર ધોકા નામના વેપારી ધંધો

dl.99:

દરમિયાન અમરેલી એસઓજીના સ્ટાફે ત્રીજા સાગરીત અક્ષય કાળુ ખંભાળિયામાં સોની બબાર વાઘેલીયાને ઝડપી લઈ મોરબી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વિસ્તારમાં ક્રિકેટ મેચનો સટ્ટો

રમતા શખસની અટકાચત

ખંભાળિયામાં આવેલ સોની બજાર વિસ્તારમાં શરણેશ્વર મંદિર

પાસે હાલમાં ચાલી રહેલ આઇ

પી એલ ૨૦૨૦ના ક્રિકેટ મેચ

દરમિયાન મોબાઈલ કોનમાં

ક્રિકબજ એપ્લિકેશન દારા પૈસાની

હાર-જીત કરી ક્રિકેટ મેચનો સફો

રમતા સોની બજાર વિસ્તારમાં

આવેલ વૈધ ફળીમાં રહેતા

ગણેશભાઈ અનાભાઈ મેટકરી

નામના શખસને રાજકોટ

સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડી

ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં

આરોપી વિરુદ્ધ ગુનો નોંધી

મોબાઇલ અને રોકડ સહિત કુલ

૧૫ હજાર નવસોના મુદ્દામાલ

સાથે અટક કરી પોલીસે આગળની

કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા,

જૂનાગઢમાં જુગારની ટેવથી યુવાન ચોરીના રવાડે ચડ્યો

જૂનાગઢ, તા.૧૧ ઃ કાજીવાડાના આદિનાથ એપાર્ટમેન્ટમાંથી હિરો હોન્ડા તથા પડોશીના એવીએટરની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી, વાન ચોરને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતે જુગારની ટેવ વાળો હોય અને પૈસાની જરૂરિયાત ઉભી થતાં બન્ને બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતાં જીજ્ઞેશ મનસુખભાઈ રાજપરાનું રૂા.૪૦ હજારનું હિરો હોન્ડા તથા પડોશી દિપક શાંતિલાલ વસાનું એવીએટરની ચોરીની ફરિયાદ બાદ, પોલીસે તપાસ હાથ ધરી કુંભારવાડામાં રહેતાં અનિશ મુસાભાઈ સીડા (ઉ.૨૨)ની ધરપકડ કરી હતી. આ શખસે જગારની આદત હોય નાશાંની જરૂરિયાત ઉભી થતાં બન્ને બાઈકની ચોરી કર્યાની કબુલાત પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બામણવા ગામે તળાવમાં ડૂબી જતા બાળકનું મૃત્યુ

વઢવાશ, તા.૧૧ : બામશવા ગામે રહેતી મહિલા તેના પુત્ર નાગરાજ (ઉ.૧૦)ને સાથે લઈને ગામના તળાવે કપડા ધોવા ગઈ હતી ત્યારે નાગરાજનું રમતા-રમતા પગ લપસી જતા તળાવમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને બાળકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મોરબીના કારખાનામાં આગ

મોરબી, તા.૧૧ : શનાળા રોડ મેટલ વર્કસના કારખાનામાં રાત્રીના કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. અશ્વિન મેટલ વર્કસ કારખાનામાં આગ ભભૂકી અને બાજુમાં કચરામાં આગ પ્રસરી હતી. આગ લાગ્યાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતાં સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.

ઓરિચેન્ટ એબ્રેસિવ્ઝ લિમીટેક CIN No. L24299GJ1971PLC093248

રજી. ઓફિસ: જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પોરબંદર-૩૬૦૫૭૭ (ગુજરાત) ટેલિ.નં.+૯૧-૨૮૬-૨૨૨૧૭૮૮ ફેક્સ +૯૧-૨૮૬-૨૨૨૨૭૧૯ developmentabrasives.com રોકાણકાર સંબંધી- ઈ-મેઈલ આઈડી: invester@oalmail.co.in

૪૯મી વાર્ષિક સાધારણ સભા અંગે સભ્યોને નોટિસ આથી આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે ઓરિયેન્ટ એબ્રેસિઝ લિમીટેડ "કંપની")ની ૪૯મી વાર્ષિક સાધારણ સભા ("એજીએમ") ગુરવાર, તા.૩જી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ બપોરે ૩.૦૦ કલાકે વિડિયો કોન્કરન્સીંગ ("વીસી/અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ (''ઓએવીએમ'') દ્વારા ૪૯મી એગ્રુએમ નોટિસ સંદર્ભમાં દર્શાવેલ કાર્યવાહી અંગે યોજવામાં આવશે. જે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ("એમસીએ")નાં ૮ એપ્રિલ, ૨૦૨૦ તથા ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના પરિપત્ર ઉપરાંત ૫ મે, ૨૦૨૦ તથા સેબી પરિપત્ર તા.૧૨ મે, ૨૦૨૦નો ("એમસીએ" અને "સેબી" પરિપત્ર), કંપનીની એડ્રાએમને વીસી/ઓએવીએમ મારફત સભા સ્થળે સભ્યોની

જામનગરમાં સમાધાન માટે મળેલા બે પરિવાર ફરીથી બાખડયાં

કરતા હતા અને રાજેશભાઈ ધોકાએ વેપારી પિતા-

પુત્રને ૧૩૪૭ ગ્રામ વજનના દાગીના આપ્યા હતા

અને સાત દિવસમાં ૨કમ ચૂકવી આપવાનું નક્કી થયું

હતું તેમજ અન્ય ગ્રાહકો અને વેપારીઓને પણ

ઝપટમાં લઈ લીધા હતા. બાદમાં દિલીપ અને તેના

પિતા જયંતિલાલ સોની તમામ મિલકત અને બાઈક-

સમક્ષ ચાલી રહયો હતો. કાનાભાઈ અને

પુત્રી હતો. આ કેસ જામનગરની કોર્ટ

દરમિયાન ગઈકાલે બંને પક્ષના સભ્યો સમાધાનના ભાગરપે જામનગરની કોર્ટના દ્વારે આવ્યા હતા. ત્યાં સમાધાન થયું નહોતું અને ફરી બાખડી પડયાં હતાં. ધરપકડ: હિંગળાજ ચોક

વિસ્તારમાં રહેતો ગોવિંદ હેમંતભાઈ કટારમલ દારૂની હેરાફેરી કરી રહયો છે અને હિરજી મિસ્ત્રી રોડ પર બાવળની ઝાડીમાં દારૂનો જથ્થો સંતાડયો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂા.૩૩,૬૦૦ની કિંમતના ૪૮ નંગ દારૂની બાટલીના જથ્થા સાથે ગોવિંદ કટારમલની અટકાયત કરી હતી.

શ્વસુર પક્ષના પાંચ સભ્યો (ફૂલછાબ ન્યુઝ) અદાલતમાં અમદાવાદના ન્યાય મેળવવા આવેલા બે દેવાભાઈ ગોહિલ, કંચનબેન કાનાભાઈ, ધર્મેન્દ્ર કાનાભાઈ, પરિવારો વચ્ચે કોર્ટની સામે જ ફરીથી ડખ્ખો સર્જાયો હતો અને જયેન્દ્ર કાનાભાઈ જગદીશભાઈ ખંભાળિયાવાળા ભાગતા જામનગરની પરિશીતાના માતા-સામે ફરિયાદ નોંધાવી છે. પિતા અને ભાઈ પર શ્વસુર ભાનુબેનની પક્ષના પાંચ સભ્યોએ હમલો

જશુમતિના લગ્ન અમદાવાદના ધર્મેન્દ્ર કાનાભાઈ સાથે બે વર્ષ પહેલા થયા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો પછી બંને વચ્ચે મનદુઃખ થતા જસુમતી પોતાના માવતરે જામનગર આવી ગઈ હતી અને પતિ સામે ભરશપોષણનો કેસ દાખલ કર્યો



કર્યા છે. અને મારકૂટ

અંગે ફરિચાદ d1.99

જામનગર, (ફૂલછાબ ન્યુઝ)ઃ હથિયાર પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ રહયો છે. મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની અને હાલ જૂનાગઢમાં રહેતો અરૂણ સુધીર યાદવ હથિયારોની હેરાફેરી કરે છે અને એક પિસ્તોલ સાથે જામનગરમાં આવ્યો છે.તેવી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હાલાર હાઉસ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી અરૂણ

પોલીસે હિતુભાને કરારી જાહેર

જામનગર.

સમાધાન પડી

કર્યાની ફરિયાદ થઇ છે.

ખોડિયાર કોલોની નજીક

નીલકમલ સોસાયટીમાં રહેતી

ભાનુબેન પરમારે (૪૮)

પોતાના ઉપર પતિ હમીરભાઈ

અને પુત્ર મહેશ ઉપર હિચકારો

હુમલો કરવા અંગે અમદાવાદના

ધોળકા રોડ પર રહેતા પુત્રીના

તા.૧૧

યુવતીની છેડતી અંગે કરિયાદ: મચ્છરનગર વિસ્તારમાં રહેતી એક યુવતીનો ગઈકાલે એક શખસે પીછો કરી છેડતીનો પ્રયાસ કર્યો હતો. તેને અટકાવવા જતા તે જ વિસ્તારમાં રહેતો એક શખસ વિકર્યો હતો અને યુવતીને ધમકી આપી હતી.

મચ્છરનગર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતી કે જે ગઈકાલે અન્નપુર્ણા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન નજીકના વિસ્તારમાં રહેતો 8 જયપાલસિંહ ચુડાસમા તેનો પીછો કરવા લાગ્યો હતો અને

છેડતીનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ તેનો વિરોધ કરતા

આરોપી ઉશ્કેરાઈ ગયો હતો

અને ધાક ધમકી ઉચ્ચારી, હડધૂત

કરી હતી. દરમિયાન યુવતીના

બહેન-બનેવી પણ આવી જતા

તેઓને પણ જાહેરમાં ગાળો





પ્રત્યક્ષ ઉપસ્થિત વિના યોજવા માટેની મંજૂરી મળેલ છે.

૪૯મી એજીએમ નોટિસના પરિપત્ર તથા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં વાર્ષિક અદેવાલ કંપનીમાં/ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ ખાતે નોંધાયેલા કંપની સભ્યોના ઈ-મેઈલ આઈડી ઉપર શુકવાર દુ નવેમ્બર, ૨૦૨૦ના રોજ મોકલી આપેલ છે. જેની સઘળી વિગતો કંપનીની વેબસાઈટ www.orientabrasives.com, સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ લિમીટેડની વેબસાઈટ www.bseindia.com એનએસઈ વેબસાઈટ www.nseindia.com તેમજ સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ (ઈન્ડિયા) લિમીટેડની વેબસાઇટ ww.evotingindia.com ઉપર ઉપલબ્ધ છે જેની કંપની સભ્યોએ નોંધ લેવી.

કંપનીના જે સભ્યોએ પોતાનું ઈ-મેઈલ સરનામું જે તે ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ ખાતે નોંધાવેલ ન હોય અને પ્રત્યક્ષ શેર ધરાવતા હોય તેમણે કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સકર એજન્ટ, મે. સ્કાયલાઈન કાયનાન્સીયલ સર્વિસીસ પ્રા.લિ.ને સંબોધીને ઈ-મેઈલ સરનામું અપડેટ કરવા માટેની સઘળી વિગતો જેવી કે નામ, ફોલિયો નં, સ્કેન કરેલ સર્ટિકિકેટ, આઈડી પૂક વગેરે admin@skylinerta.comને મોકલી આપવા વિનંતી છે.

બુક બંધ: આ નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે, કંપની ધારો ("ધી એક્ટ")ની કલમ-૯૧ના નિચમ ૧૦ (૧) કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ અનસાર કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટાન્સકર બુક શકવાર, ૨૭ નવેમ્બર, ૨૦૨૦થી ગુરૂવાર, ૩જી ડિસેમ્બર, ૨૦૨૦ (બંને દિવસો સહિત) આગામી એજીએમ હેતુસર બંધ રહેશે.

ઇ-વોટિંગ: કંપની ધારાની કલમ ૧૦૮ અને નિરામ-૨૦ (મેનેજમેન્ટ તથા એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ તેમજ સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન અને ડિસ્કલોઝર રિકવારામેન્ટ) નિરામ, ૨૦૧૫ના નિરામ ૪૪ માંદેની જોગવાઈ અનુસાર કંપનીના સભ્યોને એજીએમ નોટિસમાં મંજૂર કરવામાં તમામ ઠરાવો સંદર્ભમાં સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમીટેડ ("સીડીએસએલ") દ્વારા પોતાનો મત ઇલેક્ટ્રોનિક વોર્ટિંગ સિસ્ટમ દ્વારા રજૂ કરવાની સુવિધા ધરાવે છે. સદરહુ રિમોટ ઇ-વોર્ટિંગ/ઈ-વોર્ટિંગની વિગતવાર પધ્ધતિસરની માહિતી એજીએમ નોટિસમાં દર્શાવેલ છે.

રિમોટ ઈ-વોટિંગનો સમય સોમવાર, ૩૦ નવેમ્બર, ૨૦૨૦નાં સવારે ૯.૦૦ થી શરૂ થશે અને બુધવાર, ૨ ડિસેમ્બર, ૨૦૨૦નાં સાંજે ૫.૦૦ કલાકે બંધ થશે જે સભ્યો કંપનીની પોઈડ-અપ શેર કંપીટલના ભાગ - શેર ગુરુવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ (કટ-ઓફ ડેઈટ) ધરાવતા હશે તેઓ મત આપવા હક્કદાર રહેશે.

ઈ-વોર્ટિંગની સુવિધા એજીએમ દરમિયાન ઉપલબ્ધ થશે તથા જે સભ્યોએ ઠરાવ ઝંગે રિમોટ ઈ-વોર્ટિંગ કરેલ નહીં હોય તેઓ એજીએમની ઈ-વોર્ટિંગ સિસ્ટમ દ્વારા પોતાનો મત આપી શકશે. એજીએમ પૂર્વે જે સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ કર્યુ હશે તેઓ એજીએમ સમયે ઉપસ્થિત રહી શકશે પરંતુ પોતાનો મત ફરીથી રજૂ કરી શકશે નહીં.

કંપનીના શેર ધરાવતી કોઈપણ વ્યક્તિ અને એજીએમ નોટિસ મોકલાયા પછી કંપનીનું સભ્યપદ અને કટ-ઓફ ડેઈટ ગુરૂવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૦ના શેર સર્ટિ. ધરાવતા હોય તેઓ પોતાની સઘળી વિગતો અંગેની વિનંતી helpdesk.evoting@cdslindia.comને મોકલી શકે છે.

કંપનીના રગુસ્ટર/કટ-ઓફ ડેઈટનાં રોજ બેનીફિશિયલ ઓનર તરીકે નામ નોંધારોલ હોય તેવી જ વ્યક્તિ એજીએમ વખતે સદરહ ઈ-વોટિંગ તથા રિમોટ ઈ-વોટિંગ સુવિધા માટે હક્કદાર થશે.

ઈ-વોટિંગના સંદર્ભમાં કોઈપણ મુશ્કેલી કે મુદ્દો હોય તેવા કિસ્સામાં ફિકવન્ટલી આસ્ક કવેશન ("એફએક્યુ") તથા મેન્યુઅલ ઈ-વોટિંગ માટે હેલ્પ સેક્શન હેઠળ www.evotingindia.com ઉપર ઉપલબ્ધ છે અથવા ઈમેઈલ લખી Hisei: helpdesk-evoting@cdslindia.com


કંપનીએ એજીએમ દરમિયાન ઈ-વોટિંગ પ્રક્રિયા સુચારૂ અને સરળતાથી રિમોટ ઈ-વોટિંગ યોજાય તે અંગે સ્કુટિનાઈઝર તરીકે મિ.દીપ્તી ગોહીલની નિમણૂક કરી છે. ઓરિચેન્ટ એબ્રેસિઝ લિમીટેક વતી/-સ્થળ: મુંબઈ સલી/-બિમલ પરમાર તારીખ: ૧૧ નવેમ્બર, ૨૦૨૦ કંપની સેકેટરી

યાદવને પકડી પાડયો હતો.તેના કબજામાંથી રૂપિયા ૨૫ હજારની કિંમતની ૧ પિસ્તોલ તથા જીવંત કારતૂસનો કબજો લીધો છે.

પોલીસે હથિયારધારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેની પ્રાથમિક પૂછપરછમાં ઉપરોક્ત હથિયાર ગીર સોમનાથ સત્રાપાડાના વતની હિતેશ ઉર્ફે હિતેશસિંહ ઉર્ફે હિતભા ભગતસિંહ ઝાલાએ સપ્લાય કર્ય હોવાની કબૂલાત કરતા

આપી ધમકી આપી હતી. જિલ્લાના પોલીસે આરોપી જયપાલસિંહ ચુડાસમા સામે છેડતી તેમજ એસ્ટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. Change Of Name નામ બદલાવેલ છે I undersigned TRIVEDI JAYKUMAR આચી હું નીચે સહી કરનાર જ્યંતિભાઇ ગાંગજાભાઇ પરસાણિયા YOGESHKUMAR declars જાહેર કરૂં છું કે મેં મારૂં that I have changed my name from જરાંતિલાલ MIN Sicile **URANIFERATIONAL** TRIVEDI JAY YOGESHKUMAR GANGJI PARSANIA) Hial and now onwards I will be known as જ્યંતિભાઇ આંગજીભાઇ પરસાધિયા TRIVEDI JAYKUMAR (JAYANTIBHAI GANGJIBHAI PARSANIA) GEGICIO D. YOGESHKUMAR. સરનામું: ૩૦૩ શ્રી વલ્લભ એપા. Add. Saurabh Society,

ઝાંઝરડા રોડ - જુનાગઢ Raiya Road, Rajkot.



યા તેલા તેલા સારે મહોરબંધ ભાવપત્રી મંગાવવામાં આવે છે. અને પી.આર.ઓ.નંબર વિભાગનું નામ હન્વ મન્હ અંદાજીત રક્ષ અને પી.આર.ઓ.નંબર વિભાગનું નામ હન્વ મન્હ ગરળ ભાગ કર

૧ sssi70-૨૧ ડેનેજ.વ.ગ.પ્રોજેક્ટ ૦૩ ૨.૮૫.૦૫.૬૧૬.. ઉપરોક્ત કામના ટેન્ડર ફોર્મ તથા વિસ્તૃત માહિતી જે તે સંબંધિત વિભાગમાંથી.ઉપરોક્ત સ્થિત વેબસાઇટ પરશી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજુરાનામંજુર કરવાની અબાધિત સત્તા યુનિસિપલ કમિશનરશ્રીની રહેશે. જનસંપર્ક વિભાગ હરા પ્રથતિત 1.412.201.4.531/2020-21

RAJKOT MUNICIPAL CORPORATION e-TENDER NOTICE (Re-Tender)

The e-Tenders are invited in two bid system by Rajkot Municipal Corporation from the interested bidders for The work of "Comprehensive Electrical and Mechanical Maintenance of Cremation Furnace System Of various Crematoriums of Rajkot Municipal Corporation for three years". The last date for downloading and submission of online e-tender http://rmc.nprocure.com is 02.12.2020 up to18:00 Hrs. For more details, kindly visit http://rmc.nprocure.com Add. City Engineer

| | ડ) Iસ્ગાસ્કા (સુપર ફાસ્ટ |) 🚔 પ સ્પેશિચલ ટ્રેઇ | | પોરબંદર = મુઝ ફફ રપુર (સ્પેશિયલ ટ્રેઇન) | | | | | |
|--|---|---|--|--|---|--|--|--|--|
| ટ્રેઈન નં. | પ્રસ્થાન | આગમન | સેવાઓની તારીખ | ड्रेर्धन नं. | પ્રસ્થાન | આગમન | સેવાઓની તારીખ | | |
| 06053 | બાન્દ્રા (ટ) ૧૫.૨૫ ક. (રવિવાર) | પટના ૨૩.૪૫ ક. (સોમવાર) | ૧૫-૧૧-૨૦૨૦ | ٥૯૨૬૯ | પોરબંદર ૧૬.૩૦ ક. (શુક્રવાર) | મુઝફ્ફરપુર ૧૮.૧૦ ક. (રવિવાર) | 93-99-2020 | | |
| 06058 | પટના ૦૪.૩૦ ક. (મંગળવાર) | બાન્દ્રા (ટ) ૧૨.૪૫ ક . (બુધવાર) | 90-99-2020 | 06530 | મુઝ ફ્ફરપુર ૧૫.૧૫ ક . (સોમવાર) | પોરબંદર ૧૫.૧૦ ક. (બુધવાર) | १६-११-२०२० | | |
| જબલપુર, જંક., પંડિત બંને દિશામ સંરચના : કોચેસ. | કટની, સતના, ૧ દીન દયાલ ઉપા i. | માણીકપુર, પ્રચ ધ્યાય જંક., બસર :-3 ટાયર & સેક | મૂસાવલ, ઈટારસી, થાગરાજ છેઓકી ૨ & આરા સ્ટેશનો ન્ડ કલાસ સીટીંગ પર સીટી | આંબલી શે. અજમેર જંસ ગુરગાંવ, દીલ બરેલી (NR સીરવા બાઝ | ડ, પાલનપુર જંક ક., જયપુર જંક., ક્લી કેન્ટ., દીલ્લી સ્ !), શાહજહાંપુર, nર, બાગાહા, નરક | ., આંબૂ રોડ, મા બંદીકુઈ જંક., અ તરાઈ રોહીલા, દીલ્લ લખનૌ, ગોંદા જંક કટીઆગંજ, બેત્તી | , વિરમગામ જંક., શ્વાડ જંક., બીવર, લવર, રેવારી જંક., કી જંક., મારાદાબાદ, ક., ગોરખપુર જંક., આહ, સગૌલી જંક., | | |
| ones | | / સ્પેશિચલ ટ્રેલ | | | | & મેહસી સ્ટેશન -3 ટાયર, સેકન્ડ | ા બનાદશામાં. 5 કલાસ સીટીંગ & | | |
| ટ્રેઈન નં. | પ્રસ્થાન | આગમન | સેવાઓની તારીખ | પેન્ટ્રી કાર. | | | | | |
| ૦૯૦૧૫ સુપર ફાસ્ટ | બાન્દ્રા (ટ) ૨૩.૩૦ ક. (સોમવાર) | ગાઝીપુર સીટી ૧૦.૩૦ ક. (બુધવાર) | ૧૬-૧૧-૨૦૨૦ | ૧૨મી નવેમ્બર, ૨૦૨૦થી તમામ પેસેન્જર આરક્ષણ | | | | | |
| ૦૯૦૧૬ સ્પેશિયલ ટ્રેઈન | ગાઝીપુર સીટી ૧૯.૩૦ ક. (બુધવાર) | બાન્દ્રા (ટ) ૦૩.૫૦ ક. (શુક્રવાર) | 9८-99-२०२० | - | wid dai irct | જ વેબસાઈટ પ | રથી શરૂ થશે. | | |
| જંક., ૨ત૯ માધોપુર, ગ જંક., આગ્ર પ્રયાગરાજ | ામ જંક., શામગઢ ાંગાપુર સીટી, શ્રી 11 કેન્ટ., શામશાબ | 2, રામગંજ મંડી, મહાબીરજી, હિન્હે IIE ટાઉન, એટાવ ., મરીઆહુ, જૌન | ારૂચ જંક., વડોદરા કોટા જંક., સવાઈ દીન સીટી, બચાના ા, કાનપુર સેન્ટ્રલ, પુર જંક., ડોભી & | | રપેશિર પશ્ચિ | ચલ ટ્રેઈનો ચલ દરો પર UH રેલ્ dianrailways.gov | | | |
| સંસ્થના : કોચેસ. | AC-ક ડાચર, AC | -3 ટાચર & સેક | ન્ડ ક્લાસ સીટીંગ | અથને લાઇડ કરો: | acebook.com/West | ernRly • અલ્બે ક્રોલો કરો: 🖺 | twitter.com/WesternRly | | |











| UNION BANK of INDIA Staregi ANDHRA Corporation apritizer | यूको बैंक कि UCO BANK सम्मान आपके विश्वास का M.G. Road Branch, Badri Mansion, Opp. Hotel Relief, Cinema Road, | CIN: L23209GJ | ge Anjesar, Tal; Šavli, Dist: Vadodara, Email: barodagroup99@gmail.com. J1991PLC016666 | Gujarat, | UNION BANK हिंदी राज्य के स् oF INDIA हिंदी राज्य के संदिया S आन्ह्या के प्रतिया ANDHRA कार्पोरेशन |
|--|--|--|--|------------------------|--|
| Textile Market Branch : Surat Textile Market, Ring Road Surat, Surat-395002 | Surat-395003 PH: 0261-2423319 E-MAIL: MGROAD@UCOBANK.CO.IN | Unaudited Financial Results for on 30 th Sep | 4 h | ' ended . in Lakhs) | Pandesara Branch : 206,1431,32 Piyush Point, Opp. Bank of India, |
| Phone : 0261-2321312, 2320510 | POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.] | Sr. Particulars | Quarter ended Half Yea ended | ended | VIP Road, Pandesara, Surat- 394221 |
| POSSESSION NOTICE Schedule - 6 [Rule-8(1)] (For Immovable Property) | Whereas, the undersigned being the Authorised Officer of the UCO BANK under | No. | 30.09.2020 30.09.2019 30.09.201 (Unaudited) (Unaudited) (Unaudited) | | POSSESSION NOTICE Schedule - 6 [Rule-8(1)] (For Immovable Property) |
| Whereas, | Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers | 1. Total Income from Operations | 30.51 0.00 34.88 | 959.70 | Whereas, |
| The undersigned being the Authorized Officer of the Union Bank of India, Textile | conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules | 2. Net Profit/(Loss) for the period (before tax Exceptional Items & or Extraordinary Item | | (18.05) | The undersigned being the Authorized Officer of the Union Bank of India, |
| Market Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 (3 of 2002) and in exercise of powers | 2002, issued a Demand Notice dated 28-02-2020 calling upon the Borrower / Guarantor (1) Mr. Mineshkumar Dahyabhai Patel (2) Mrs. Ilaben Mineshbhai Patel to repay the | 3. Net Profit/(Loss) for the period before tax | (2.83) (8.01) (12.22) | (18.05) | (Erstwhile-Corporation Bank), Pandesara Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), |
| conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) | amount mentioned in the notice, being Rs.12,71,835.00 (Rupees Twelve Lacs Seventy | (after exceptional and/or Extraordinary Item 4. Net Profit/(Loss) for the period after tax (aft | | (18.05) | 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice |
| Rules, 2002 issued a demand notice dated 02.02.2019 under section 13 (2) of the said act calling upon the Borrowers and Guarantor Kishor Eknath Salape to repay the | One Thousand Eight Hundred Thirty Five Only) plus Uncharged Interest within 60 days from the date of receipt of the said notice. | exceptional and/or Extraordinary Items) 5. Total comprehensive income for the period | | · , | dated 23.01.2020 under section 13 (2) of the said act calling upon the Borrowers and |
| amount mentioned in the notice being Rs. 9,04,759.87 (Rupees Nine lacs Four | The borrower/ Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of | [comprising profit/(loss) for the period (after ta | | (18.05) | Guarantor Mr. Krishna Kumar Singh (Borrower), Mrs. Ruhi Krishna Kumar Singh (Co-Borrower) and Mr. Mahendra Sudambhai Gurav (Guarantor) to repay the |
| Thousand Seven Hundred Fifty Nine and Eighty Seven Paise Only) as on 31.01.2019 with further interest thereon & expenses within 60 days from the date of receipt of the | the property described herein below in exercise of powers conferred on him / her under | and other comprehensive income (after tax)]6. Reserves (excluding Revaluation Reserve) as | | (1065.27) | amount mentioned in the notice being Rs. 9,44,577.50/- (Rupees:- Nine Lakh Forty |
| said notice. | section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 6th day of November of the year 2020. | shown in Audited Balance Sheet of previous ye | ear | () | Four Thousand Five Hundred Seventy Seven and Paisa Fifty Only) as on 24.10.2019 with further interest thereon & expenses within 60 days from the date of |
| The borrowers and guarantor having failed to repay the amount, Notice is hereby | The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the | 7. Earning per share Note: | (0.05) (0.15) (0.23) | (0.34) | receipt of the said notice. |
| given to the borrowers and guarantor and public in general that the undersigned has taken Physical Possession of the property owned by Kishor Eknath Salape described | property and any dealings with the property will be subject to the charge of Uco Bank for an amount of Rs.12,71,835.00 plus applicable charges and interest thereon. | 1. The above Financial Results have bee Accounting Standards (Ind As) specified u | en prepared in accordance with | the Indian | The borrowers and guarantor having failed to repay the amount, Notice is hereby |
| herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act | The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets. | read with relevant Rules. | | | given to the borrowers and guarantor and public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of |
| read with rule 8 & 9 of the said rules on this 10 day of November, of the year 2020 . | Description of the Immovable Property | The above results have been reviewed b by the Board of Directors at their Meeting | | d approved | powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 & 9 of the |
| The borrowers/secured debtors / guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will | All the parts and parcel of land & Building thereon at Plot No.82, of "Sukh | 3. The Company operates under single seg | gment. By the Order of | the Board | said rules on this 10th day of November of the year 2020. |
| be subject to the charge of the Union Bank of India, Textile Market Branch, Surat for | Darshan Row House" admeasuring 53.43sq.mtrs situated at the land | Date : 11.11.2020 | -/Sd Jaykishor Cl | | The borrowers/secured debtors / guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property |
| an amount Rs. 9,04,759.87 (Rupees Nine lacs Four Thousand Seven Hundred Fifty Nine and Eighty Seven Paise Only) as on 31.01.2019 with further interest thereon Plus | bearing R.S. No. 97/8, (Block No. 113)of Village: Antroli, Sub-Disrict: | Place : Vadodara | Managing D | | will be subject to the charge of the Union Bank of India, (Erstwhile-Corporation |
| other Charges. | Kamrej, District: Surat.(Gujarat). Date: 06-11-2020 Authorised Officer, Uco Bank, | | | | Bank), Pandesara Branch, Surat for an amount Rs. 9,44,577.50/- (Rupees:- Nine Lakh Forty Four Thousand Five Hundred Seventy Seven and Paisa Fifty Only) as |
| The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of | Place: Surat. M G Road Branch, Surat. | राजने जेंग | | | on 24.10.2019 with further interest thereon Plus other Charges. |
| the Act, in respect of time available, to redeem the secured assets. DESCRIPTION OF IMMOVABLE PROPERTY | | | | | The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. |
| All that piece, part and parcel of Immovable Property: Residential property | | M.G. Road Branch, Badri Mansio | | | DESCRIPTION OF IMMOVABLE PROPERTY |
| Flat No. C-207, Sai Residency, Dindoli, Surat. Gujarat. Sd/- | | Surat-395003 PH: 0261-2423319 E | <u> </u> | | Title in respect of the immovable property bearing Plot no. 107, adm 40.13 |
| Date : 10.11.2020 Authorised Officer, | | POSSESSION NOTICE [SECTIO [Under Rule-8(1) of Security Int | terest (Enforcement) Rules | 2002 1 | sq.mtrs. I.e. aquivalent to 48.00 sq yards of society known as "Aradhana Lake |
| Place : Surat Union Bank of India | ORIENT ABRASIVES LIMITED | Whereas, the undersigned being the Au | · · · · · | | Town, Vibhag-1", alongwith undivided proportionate share adm about 22.10 sq mtrs. In the common roads and COP of the said society, situated on the |
| | CIN No.: L24299GJ1971PLC093248 | Securitisation And Reconstruction of Fin | ancial Assets and Enforcement | of Security | land bearing R.S. no. 2/2 it's Block no. 2 of Moje Village- Jolva, Taluka- |
| | Regd. Office: GIDC Industrial Area, Porbandar - 360577 (Gujarat). | Interest Act, 2002 (Act 54 of 2002) (hereina powers conferred under Section 13 (12) | | | Palsana, Dist- Surat. |
| HDB FINANCIAL Registered Office: Radhika, 2nd Floor,Law Garden Road, | Tel. No.:+ 91 - 286-2221788 Fax: + 91 - 286-2222719 Website: www.orientabrasives.com, | (Enforcement) Rules 2002, issued a Dema | and Notice dated 18-01-2020 callir | g upon the | Bounded by: •East : Plot No. 104, •West : Internal Road of Society •North : Plot No. 108, •South : Plot no. 106 Sd/. |
| Navrangpura, Ahmedabad, Gujarat, Pincode- 380009 | Investors Relations E-mail ID: investor@oalmail.co.in | Borrower / Guarantor (1) Mrs. Shobhak Shivdasbhai Gosavi to repay the amount r | | | • North : Plot No. 108, • South : Plot no. 106 Sd/- Date : 10.11.2020 Authorised Officer, |
| Regional Office: 2nd Floor, Plot No. 345, Ward 12/B, Tagore Road, Above SIDBI Banking Square Land Mark: Opposite Fedral Bank, Gandhidham- 370201 | NOTICE TO THE MEMBERS OF 49 [™] ANNUAL GENERAL MEETING | (Rupees Nine Lacs Thirty Seven Thous Uncharged Interest within 60 days from the o | | Only) plus | Place : Surat Union Bank of India, (Erstwhile-Corporation Bank) |
| DEMAND NOTICE 'UNDER SECTION 13 (2) OF THE SARFAESI ACT, 2002 | Notice is hereby given that $49^{\rm m}$ Annual General Meeting ("AGM") of Orient Abrasives Limited | The borrower/ Guarantor having failed to re- | epay the amount, notice is hereby | | |
| You, below mentioned borrowers, co-borrowers and guarantors have availed loan(s) facility(ies) from HDB Financial Services Limited branch Gandhidham, by mortgaging your | ("Company") will be held on Thursday, the 3 ^{ed} day of December, 2020 at 3:00 p.m. through Video Conferencing ("VC / Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the | borrower and the public in general that the of the property described herein below in ex | | | UNION BANK 🌈 युनिथन अं ड |
| immovable properties (securities) you have not maintained your financial discipline and | Notice convening 49 th AGM. In line with the Circulars issued by Ministry of Corporate Affairs | section 13 (4) of the said Act, read with Ru | | | OF INDIA U ચાર હાર્કિયા |
| defaulted in repayment of the same. Consequent to your defaults your loans were classified as non-performing assets as you to avail the said loan(s) along with the | ("MCA") dated 8 th April, 2020 and 13 th April, 2020, followed by the Circular dated 5 th May, 2020 and | November of the year 2020. The borrower in particular and the public in | general are hereby cautioned not | o deal with | S ANDHRA (Corporation ANDHRA कार्पोरेशन |
| underlying security interest created in respect of the securities for repayment of the same. The HDBFS has right for the recovery of the outstanding dues, now issued demand notice | SEBI Circular dated 12 th May, 2020 (collectively referred to as "MCA" and "SEBI" Circulars), AGM of the Company is permitted to be held through VC/OAVM without the physical presence of the | the property and any dealings with the prop | perty will be subject to the charge of | Uco Bank | |
| under section 13(2) of the Securitization and Reconstruction of Financial Asset and | Members at a common venue. | for an amount of Rs.9,37,983.00 plus appli The borrower's attention is invited to the pro | | | Pandesara Branch : 206,1431,32 Piyush Point, Opp. Bank of India, VIP Road, Pandesara, Surat- 394221 |
| Enforcement of Security Interest Act, 2002 (the Act), the contents of which are being published herewith as per section 13(2) of the act read with rule 3(1) of the security | In compliance with the Circulars, Notice of the 49 th AGM along with Annual Report for the Financial | of time available, to redeem the secured ass | sets. | | POSSESSION NOTICE |
| interest (enforcement) rules, 2002 as and by way of alternate service upon you. Details of | Year 2019-2020 has been sent to all members whose e-mail ids are registered with the | Description of the | Immovable Property | | Schedule - 6 [Rule-8(1)] (For Immovable Property) |
| the Borrowers, Co-borrowers, Guarantors ,Loans, Securities, Outstanding dues, Demand Notice sent under section 13(2) and Amount claimed there under are given below: | Company/Depository Participant (s) as on Friday, 6 [™] November, 2020. Members may note that the same is available on the website of the Company at www. orientabrasives.com, website of the | All the parts and parcel of land & B | | | Whereas, |
| 1. Borrower and Co-Borrowers: 1. Gulab Cloth Store 2. Nilesh Kishor Bhagtani 3. Prakash | stock exchanges i.e. BSE Limited www.bseindia.com, at NSE at www.nseindia.com and website of | Darshan Residency" situated at the 121)of Village: Bagumara, Sub-Distr | J | | The undersigned being the Authorized Officer of the Union Bank of India, (Erstwhile-Corporation Bank), Pandesara Branch, Surat under the Securitization |
| Gulabrai Bhagtani 4. Jyoti Prakash Bhagtani All R/o At (A) G G Handloom House Shop No- S-101 Main Bazar Gandhidham-370201 (B) Plot No-101 Ward-10 B-C Opp Iffco | Central Depository Services (India) Limited at www.evotingindia.com. | Date: 06-11-2020 | Authorised Officer, U | | and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), |
| Gandhidham- 370201. (2) Loan Account Number: 3379017 (3) Loan Amount In Inr: Rs.10400000 (Rupees One Crore Four Lakhs Only) (4) Detail Description Of The | Members who have not registered their email address, so far, are requested to register their e-mail | Place: Surat. | M G Road Brand | , , | 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated |
| | address with their respective Depository Participants and Members holding share in physical form | | | | 18 02 2020 under section 13 (2) of the said act calling upon the Borrowers and |

1. Borre Gulabra S-101 Gandhidham- 370201. (2) Loan Account Number: 3379017 (3) Loan Amount In Inr: Rs.10400000 (Rupees One Crore Four Lakhs Only) (4) Detail Description Of The Security: Mortgage Property:- Stall No-s-102, Ward 12/A, Main Market, Gandhidhamkutch- 370201 (5) Demand Notice Date: 30/09/2020 (6) Amount Due in INR Rs. 10737297 (Rupees one crore seven lakh thirty seven thousand two hundred ninety six only) as of 26/09/2020 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc.

2. Borrower and Co-Borrowers: 1. Karsan Ravji Bhanushali 2. Kheraj Ravji Bhanushali 3. Madhavji R Bhanushali 4. Manjulaben K Bhanushali 5. Ganesh Wood Art 6. Manibai Madhavji Bhanushali 7. Lilawarii Kheraj Bhansushali Ali R/o At (A) Plot No 88 Ward 9/a Bharat Nagar Gandhidham-370201 (B) Plot No 139 Ward 9/A (E) Bharat Nagar Gandhidham- 370201, (C) Ganesh Wood Art Plot No 138 Gidc Gandhidham- 370201, (2) Loan Account Number: 4594716 (3) Loan Amount in INR: Rs.10900000 (Rupees One Crore Nine Lakhs Only) (4) Detail description of the Security: Mortgage Property :- (P.1) PLOT NO 88 WARD 94 (E), Situated at GANDHIDHAM, Dist Kutch-370201 (E) PLOT NO 139, WARD NO 9A(E), Situated at GANDHIDHAM, Dist Kutch-370201 (5) Demand Notice Date: 30/09/2020 (6) Amount Due in INR Rs. 11237420 (Rupees one crore twelve lakh thirty seven thousand four hundred twenty only) as of 26/09/2020 and future contractual interest till actual realization together with incidental expenses, cost and charges etc

3. Borrower and Co-Borrowers: 1. Shree Krishna Saintryware And Hardware 2. Premij Parshottam Kataria 3. Jeram Parsotma Katariya 4. Ratilal Parsotma Katariya 5. Keshiji Parshotam Katriya 6. Ranjanben Premji Katariya All R/o At (A) Shop No.20 Shre Hari Narayan Arcade Anjar Anjar Anjar-370110 (B) B Mistri Bording Hadda Vadi Anjar Anjar Anjar-370110. (2) Loan Account Number: 1503907 (3) Loan Amount in INR: Rs.5200000 (Rupees Fifty Two Lakhs Only) (4) **Detail description of the Security** Mortgage Property:- (P.1) Shop No. 20, admeasuring about 30.25 Sq. Mtrs Constructed or Ground Floor of Plot No. 1, Comprised in Revenue Survey No.18/1/P/1, City Survey Ward No.02, Seat No. 172, City Survey No. 3793/2/1 Known as "Shree Hari Narayan Nagar" Situated in Anjar, Taluka Anjar. Kutch in Sub-Registration District of Anjar, Registration District of Kutch. (P2) Shop No. 19, admeasuring about 30.25 Sq.Mtrs Constructed or Ground Floor of Plot No. 1, Comprised in Revenue Survey No.18/1/P/1, City Survey Ward No.02, Seat No. 172, City Survey No. 3793/2/1 Known as "Shree Hari Narayan Nagar Situated in Aniar, Taluka Aniar-Kutch in Sub- Registration District of Aniar, Registration District of Kutch. (5) Demand Notice Date: 30/09/2020 (6) Amount Due in INR Rs 2793500/- (Rupees twenty seven lakh ninety three lakh five hundred) as of 26.09.2020

Members who have not registered their email address, so far, are requested to register their e-mail are requested to update their e-mail address with the Company's Registrar & Transfer Agents, M/s

scanned Certificate, ID Proof etc. to: admin@skylinerta.com. Book Closure: Notice is also hereby given that pursuant to Section 91 of the Companies Act ("the

forthcoming AGM.

on Wednesday, 2nd December, 2020 at 05:00 p.m. The voting rights of Members shall be in proportion to their shares of the paid-up equity shares capital of the Company as on Thursday, 26" November, 2020 (cut-off date).

AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes member of the Company after

2020 may obtain their login details by sending a request at: helpdesk.evoting@cdslindia.com A person, whose name appears in the Register of Members / Beneficial owners as on cut-off date

One Global Service Provider Limited (Formerly known as Overseas Synthetics Limited) Regd. Office: Block No. 355, Marjusar Kumpad Road, Village - Manjusar, Taluka - Savii, Vadodara - 391775 Gujarat | CIN: L74110GJ1992PLC017316 Email: overseassltd@gmail.com Tel. No.: 0265 2981195 [Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015]

| Sr. No. | Particulars | Quarter ended (01/07/2020 to 30/09/2020) (Un-audited) | Year to date Figures (01/04/2020 to 30/09/2020) (Un-audited) | Previous Year ending 31/03/2020 (Audited) | Correspondi 3 months end in the previous (01/07/2019 t 30/09/2019) (Un-audited |
|------------|--|---|---|--|---|
| 1 | Total Income from Operations | 60.00 | 60.00 | - | |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 57.90 | 52.91 | (30.24) | (6.58 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 57.90 | 52.91 | (30.24) | (6.58 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#) | 57.90 | 52.91 | (30.24) | (6.58 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 57.90 | 52.91 | (30.24) | (6.58 |
| 6 | Equity Share Capital | 710.47 | 710.47 | 710.47 | 710.4 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | - | - | (457.50) | |
| 8 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - | | | | |
| | Basic : Diluted : | 0.81 0.81 | 0.74 0.74 | (0.43) (0.43) | (0.09 (0.09 |

The above unaudited financial results have been taken on record by the Board of Directors of the Company a its meeting held on 10th November, 2020. The Statutory Auditors have carried out a limited review of the above

Lakh Seventy Seven Thousand One Hundred Sixty Seven Only) as on 12.01.2020 vith further interest thereon Plus other Charges. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. DESCRIPTION OF IMMOVABLE PROPERTY Immovable property bearing Plot no. 58, adm 65.14 sq.mtrs. Together with undivided proportionate share adm 43.98 sq mtrs. In the common roads and COP of the society known as "Shiv Bunglows" situated on the land bearing new Revenue no. 41, (Old Block Nos. 41 & 42); of moje- Village- Umra, Taluka- Olpad,

18.02.2020 under section 13 (2) of the said act calling upon the Borrowers and

uarantor Mr. HardikKumar Vitthalbhai Bavisa (Borrower), Mrs. Geetaber

mount mentioned in the notice being Rs. 22,77,167/- (Rupees:- Twenty Two Lakh

Seventy Seven Thousand One Hundred Sixty Seven Only) as on 12.01.2020 with

further interest thereon & expenses within 60 days from the date of receipt of the said

The borrowers and guarantor having failed to repay the amount, Notice is hereby

given to the borrowers and guarantor and public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of

powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 & 9 of the

The borrowers/secured debtors / guarantor in particular and the public in general is

nereby cautioned not to deal with the property and any dealings with the property wil

e subject to the charge of the Union Bank of India, (Erstwhile-Corporation Bank)

Pandesara Branch, Surat for an amount Rs. 22.77.167/- (Rupees:- Twenty Two

aid rules on this 10th day of November of the year 2020.

HardikKumar Bavisa (Co-Borrower) and Mr. Girdharbhai D Vaghasiya to repay th

•West : Adj. Wado Society Road • South : Plot no. 59 Sd/

address with their respective Depository Participants and Members holding share in physical form Skyline Financial Services Pvt. Ltd. by sending an email along with details like Name, Folio No.

Act") read with Rule 10 (1) of the Companies (Management and Administration) Rules, 2014, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 27th November, 2020 to Thursday, 3rd December, 2020 (both days inclusive) for the purpose of the

E-voting: Pursuant to Section 108 of the Act and read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of AGM using electronic voting system provided by Central Depository Services (India) Limited ["CDSL"]. Detailed procedure for remote e-voting / e-voting at AGM is provided in the Notice of the AGM

The remote e-voting period commences on Monday, 30th November, 2020 at 09:00 a.m. and ends

The facility for e-voting shall be made available during AGM and those members who have not casted their vote on the resolutions through remote e-voting shall be eligible to vote through evoting systems at the AGM. The members who have casted their vote by remote e-voting prior to the

dispatch of the Notice of AGM and holding shares as on cut-off date i.e. Thursday, 26th November,

Dist-Surat. Bounded by :

• East : Adj Society Road, • North : Plot No. 57,

| and future contractual interest till act cost and charges etc. | ual realization to | only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. | | | | | financial results. 2)The statement have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, | Date : 10.11.2020 Authorised Officer, Place : Surat Union Bank of India, (Erstwhile-Corporation Bank) | | | | | |
|---|---|--|---|--|--|------------------|--|--|--|---|--|---|--|
| 1. The Borrower and Co-Borrowers/Gu above mentioned demanded amount w within 60 days of this notice failing wh shall be constrained to take action | rith further interes iich the Undersign under the Act t | In case, you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to: helpdesk.evoting@cdslindia.com The Company has appointed Ms. Dipti Gohil, Practicing Company Secretary as the Scrutinizer to | | | | elp section or | 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable. 3) The Company expects to recover the carrying amount of such assets and does not anitcipate any impariment to these financial and non-financial assets. However, the impact assessment of COVID-19 is a continuing process given the uncertainies associated with its nature and duration. The Company is monitoring the situation closely any | Place | , gurat Union dank of | יוומוס, (בדאנשווויפ-Gorporation Bank | | | |
| securities. Please note that, as per s restrained from transferring the above | ection 13(13) of -referred securities | scrutinize the voting process at the AGM and | | | , | | material changes to future economic condition and take actions as are appropriate based on future economic conditions. 4) The Previous period's figures have been regrouped/rearranged/reclassified wherever necessary to suit the | | | | | | |
| License or otherwise without the con Settlement, Please Contact: Mr. Prash | sent of HDBFS . | 3.For any query | or Full and Final | manner. | | oung proces | | a cranoparone | present layout. For One Global Service Provider Limited (Formerly known as Overseas Synthetics Limited) | | | | |
| Officer or Mr. Girraj Parashar Mobile No | | | | For Orie | ent Abrasiv | | Sd/- | | FORM | - | | | |
| D-4 40.44.2020 | | | Sd/- For HDBFS | Place: Mumbai | | | Ri | -/Sd mal Parmar | Vijay Dhawangale Place : Mumbai Nanaging Director | | | | |
| Date: 12.11.2020 Place: Gandhidham | | | horised Officer | Dated: 11 th November, 2020 Company Secretary | | | | | Date : 10-11-2020 DIN: 01563661 | (Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016 | | | |
| | | | | | | | | | | | RELEVANT PARTICULARS | | |
| | | | | | | | | | | 1 | Name of corporate debtor | VARDHMAN VITRIFIED PRIVATE LIMITED (IN CIRP) | |
| | | | | | | | | | | | Date of incorporation of corporate debtor | 24.07.2009 | |
| | | | | | | | | | | | Authority under which corporate debtor is incorporated / registered | Registrar of Companies - Ahmedabad | |
| RAGHUVIR | SYNTH | TICS LI | MITED | OMKAR OVER | SEAG | | TTED | | Gradienteric States and States a | | Corporate identity number / limited liability | U26913GJ2009PTC057603 | |
| Regd. Office: Rakhi | | | | Registered Office : 212, New Clo | | | | | Chakli Circle, Old Padra Road, Vadodara-390007 | i | identification number of corporate debtor | | |
| | 17119GJ1982 | | | Ahmedabad - 380002 P | hone No. : | 91-79-22 | | aip ai , | Corporate Office : ICICI Bank Tower, Bandra-Kurla Complex, Mumbai - 400 051. India. | | Address of the registered office and principal office (if any) of corporate debtor | S. No. 113/1, & 113/2/1, Vill. Lakaddhar, Tal. Wankaner, Lakaddhar Gujarat- 363622 | |
| STATEMENT OF UN-A | | | | CIN : L51909G Website : www.omkaroverseasltd.com | | | eas212@n | mail.com | POSSESSION NOTICE [Rule – 8(1)] | | Insolvency commencement date of the | 10.09.2020 { Physical copy of NCLT | |
| FOR THE PERIOD END | ED ON 30 TH | SEPTEMB | ER, 2020 | | Website : www.omkaroverseasltd.com E-mail: omkaroverseas212@gmail.com EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL | | | | Wheare as, the undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the | | corporate debtor | order received on 12/09/2020 } | |
| | Rs. In Lakhs | | , | RESULTS FOR QUARTE | | | | | Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security | | Date of invitation of expression of interest Eligibility for resolution applicants under | 12.11.2020 Can be obtained by emailing at: | |
| Particulars | Current Quarter | Previous Year | Corresponding 3 months ended | ON 30TH SEPT | | <u>, '</u> | · · · | in Lakhs) | Interest Act, 2002 (hereinafter the "said Act") and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002. | | section 25(2)(h) of the Code is available at: | cirp.vvpl@gmail.com | |
| | Ending | Ending | in the previous year | Particulars | Quarter ended | Half Year | Corresponding 3 months | Year ended | (hereinafter the "said Rules") issued a demand notice dated November 11, 2019 bearing | | Norms of ineligibility applicable under section 29A are available at: | Can be obtained by emailing at : | |
| | 30-09-2020 | 30-09-2020 | 30-09-2019 | | on | ended | ended in the | | reference no. ICKOL/SMEAG/2019-20/105 under Section 13(2) of the said Act calling | | Last date for receipt of expression of interest | cirp.vvpl@gmail.com | |
| | UNAUDITED | UNAUDITED | UNAUDITED | | 20 00 2020 | on 30-09-2020 | previous year 30-09-2019 | 31-03-2020 | upon you being the mortgagor, namely M/s. Anuj Printing Works Private Limited & Mr. Mahendra Kumar Saraogi to repay the aggregate amount of Rs. 37,07,60,475.58 | | Date of issue of provisional list of | 10.12.2020 | |
| Total Income from Operations | 4436.82 | 5634.30 | 1632.78 | | 30-09-2020 (Unaudited) | (Unaudited) | (Unaudited) | (Audited) | (Rupees Thirty Seven Crore Seven Lakh Sixty Thousand Four Hundred Seventy | | prospective resolution applicants | | |
| Net Profit / (Loss) for the | 4430.62 | 5054.50 | 1032.76 | - Total Income from Operations | 2.80 | 2.80 | 0.00 | 31.75 | Five and Fifty Eight Paisa only) towards the dues of the borrower, namely Anuj Textiles Private Limited as on March 11, 2020 along with further applicable interest, penal | ľ | Last date for submission of objections to provisional list | 15.12.2020 | |
| period (before Tax, Exceptional and / or | | | | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or | | | | | interest, premia, charges, etc. there after as per the agreed terms within 60 days from the | | Date of issue of final list of prospective resolution applicants | 25.12.2020 | |
| Extraordinary items) | 240.84 | 304.87 | 39.64 | Extraordinary items) | 0.32 | (3.14) | (0.61) | 0.29 | date of receipt of the said notice. The guarantors/mortgagors/borrower having failed to repay the amount, notice is hereby | | Date of issue of information memorandum, | 10.12.2020 | |
| Net Profit / (Loss) for the period before tax | | | | Net Profit / (Loss) for the period before tax (after Exceptional | | | | | given to the borrower/mortgagor and the public in general that the undersigned has taken | | evaluation matrix and request for resolution | | |
| after Exceptional items | | | | and / or Extraordinary items) | 0.32 | (3.14) | (0.61) | 0.29 | symbolic possession of the property described herein below in exercise of powers | | plans to prospective resolution applicants Manner of obtaining request for resolution | The request for resolution plan, evaluation | |
| and/or Extraordinary items) | 240.84 | 304.87 | 39.64 | - Net Profit / (loss) for the period after tax (after Exceptional and / | | | | | conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 6th Day of November. 2020. | F | plan, evaluation matrix, information | matrix, information memorandum and | |
| Net Profit / (Loss) for the period after tax | | | | or Extraordinary items) | 0.32 | (3.14) | (0.61) | 0.19 | The guarantors/mortgagors/borrower in particular and the public in general are hereby | | memorandum and further information | further information will be shared by the | |
| (after Exceptional and/or Extraordinary items) | 169.23 | 217.14 | 17.01 | Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for | | | | | cautioned not to deal with the secured properties and any dealings with the secured properties will be subject to the charge of ICICI Bank Limited for an amount of Rs . | | resolution professional with shortlisted prosp eligibility criteria as set out by the COC & Com | pliance with Sec 29A of the IBC 2016 after | |
| Total Comprehensive | | | | the period (after tax) and other | 0.00 | (0.44) | (0.04) | 0.40 | 37,07,60,475.58 (Rupees Thirty Seven Crore Seven Lakh Sixty Thousand Four | | receiving undertaking as per Sec 29 (2) of IBC 20 Last date for submission of resolution plans | | |
| Income for the period [Comprising Profit / (Loss) | | | | comprehensive Income (after tax) - Paid-up Equity Share Capital | 0.32 492.36 | (3.14) 492.36 | (0.61) 492.36 | 0.19 492.36 | Hundred Seventy Five and Fifty Eight Paisa only) and interest thereon. | | Manner of submitting resolution plans to | | |
| for the period (after tax) | | | | - Reserves (excluding Revaluation | 102.00 | 102.00 | 102.00 | 102.00 | The mortgagors'/guarantors' attention is invited to provisions of sub-section (8) of Section 13 of the said Act, in respect of time available, to redeem the secured assets. Please note | | resolution professional | Sealed Envelope by post / hand to RP at corresponding address and electronic | |
| and Other Comprehensive Income] | 170.51 | 217.51 | 17.99 | Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | _ | | | 5.44 | that no further notice will be issued. | | | copy by email at; cirp.vvpl@gmail.com | |
| Equity Share Capital | 385.41 | 385.41 | 385.41 | - Earnings per Share (of Rs. 10/- each) | | | | 0.44 | DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY OF THE MORTGAGOR | | Estimated date for submission of resolution blan to the Adjudicating Authority for approval | 25.01.2021 | |
| Reserves (excluding | | | | (for continuing and discontinued operations) | | | | | 1) All the land and Building in the name of Anuj Printing Works Private Limited at | | Name and registration number of the | Name: Sunit Jagdishchandra Shah | |
| Revaluation Reserve) as per Balace Sheet of the | | | | - Basic | 0.006 | (0.063) | (0.012) | 0.004 | Vasuki, Udyog Nagar, District Rajkot morfully being; | n | esolution professional | IP Reg. No: IBBI/IPA-00I/IP-P00471/2017-18/10814 | |
| previous accounting year | - | - | - | - Diluted | 0.006 | (0.063) | (0.012) | 0.004 | All the piece or Parcels of Freehold land situate laying and being at an Industrial | 20 N | Name, Address and E-mail of the resolution professional, as registered with the Board | Name: Sunit Jagdishchandra Shah | |
| Earnings Per Share (of Rs. 10 /- each) (for continuing | | | | Notes : | | | | | Building with land adm. 8002 – 19 sq. Mts. Of Plot No. 1 of Jetpur Revenue Survey No. 800/4 (P), Vasuki, Udyog Nagar, District : Rajkot respectively i.e together with | p | professional, as registered with the board | Address: 303, 3rd Floor, Abhijeet-1, opp. Bhuj Mercantile Bank, Mithakhali | |
| and discontinued operations) | | | | The above is an extract of the detail Unaudited Financial Results filed with | | | | | residential building thereon. | | | Six Road, Navrangpura, Ahmedabad-6 | |
| 1) Basic: 2) Diluted: | 4.39 4.39 | 5.63 5.63 | 0.46 0.46 | the SEBI (Listing and Other Disclosure | Requireme | ents) Regul | ations, 2015 | 5. The Full | Together with all buildings and structures thereon and all plants and machinery | | A debugger and Elling it is the superdiffer | Email id: sunit78@gmail.com | |
| NOTES: 1. The above is an extract of th | | | | format of the unaudited Financial Results - www.bseindia.com & on company's | | | | | attached to the earth or permanently fastened to anything attached to the earth both present and future. | | Address and E-mail to be used for correspondence with the resolution | Address: 303, 3rd Floor, Abhijeet-1, opp. Bhuj Mercantile Bank, Mithakhali | |
| the quarter & half year ended on 30/09 lation 33 of the SEBI (Listing and Oth | | | | 2) The above financial results have be | en review | ed by the | Audit Comr | nittee and | 2) All the land and Building in the name of Mr. Mahendra Kumar Saraogi at Vasuki, | | professional | Six Road, Navrangpura, Ahmedabad-6 | |
| The full format of the Un-audited Fina | ncialResults are | available on th | e websites of the | approved by the Board of Directors in | | | | | Udyog Nagar, District Rajkot morfully being; | | Trouble of Details and an Article of Article | Email id: cirp.vvpl@gmail.com | |
| Stock Exchange www.bseindia.com a 2. Figuresof the previous quarter/pe | | | | The company has adopted Indian Acc Ministry of Corporate Affairs with effect fr | | | | | All the piece or Parcels of Freehold land situate laying and being at an Industrial Building with land adm. 3574–1 sg. Mts. Of Plot No. 5 - 7 of Jetpur Revenue Survey No. | | Further Details are available at or with Date of publication of Form G | Available with the Resolution Professiona 12.11.2020 | |
| 2. Figuresof the previous quarter/period/year have been regrouped or rearranged, wherever necessary. For & on behalf of Board of Directors of | | | | Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter and Half Year ended on 30th September, 2020 in accordance | | | | accordance | | | | Sunit Jagdishchandra Sha | |
| Place Abmodated | Ragh | tics Limited R. Agarwal | with IND-AS and other accounting principles generally accepted in India. For, Omkar Overseas Limited | | | | | building thereon. | | | essional of Vardhman Vitrified Pvt. Lt dress: 303, 3rd Floor, Abhijeet-I, 0pp. Bh | | |
| Place : Ahmedabad Date : 10-11-2020 | Chairma | in & Manag | ing Director 0.: 00265303 | Date: 10/11/2020 Ramesh Deora | | | | | Date : 12 / 11 / 2020 Sd/- Date: - 12th November, 2020 Mercantile Bank, Mitha | | | | |
| Duto . 10-11-2020 | | DIN No | 0.: 00265303 | Place:Ahmedabad Dire | ctor & Cl | EO - DIN | : 001135 | 440 | Place : Jetpur (Rajkot) (Authorized Officer), ICICI Bank Ltd. | Place: | :- Ahmedabad | Navrangpura, Ahmedabad | |